



RAGHUVIR SYNTHETICS LIMITED

REGD. OFF : RAKHIAL ROAD, RAKHIAL, AHMEDABAD-380 023, INDIA

PHONE : 079-22911015 - 22911902 - 22910963

Email : raghuvirad1@sanchamel.in

Website : <http://www.raghuvir.com>

CIN : L17119GJ1982PLC005424

DATE: 22/08/2020

TO
THE MANAGER
DEPARTMENT OF CORPORATE SERVICES
BSE LTD.
DALAL STREET, FORT,
MUMBAI - 400 001

Dear Sir/ Madam

SUBJECT: DISCLOSURE UNDER REGULATION 29 AND 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2015- NOTICE TO HELD BOARD MEETING FOR UN-AUDITED FINANCIAL RESULTS - PUBLISHED IN NEWSPAPERS

REF: SCRIP CODE: 514316

Further to our letter dated 21st August, 2020, in terms of Regulation 29 read with regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed a newspaper extract of notice to held Board meeting for standalone un-audited financial results of the Company for the quarter ended on 30th June, 2020 published in English newspaper "BUSINESS STANDARD" and vernacular newspaper "JAI HIND", dated 22nd August, 2020

You are requested to take the aforesaid on record.

Thanking you,

Yours faithfully

**FOR RAGHUVIR SYNTHETICS LIMITED
FOR, RAGHUVIR SYNTHETICS LIMITED**


DIRECTOR/AUTHORISED SIGNATORY

SUNIL R. AGARWAL

CHAIRMAN & MANAGING DIRECTOR

DIN: 00265303

PUBLIC NOTICE ENVIRONMENTAL CLEARANCE
It is hereby informed that the State Level Environmental Impact Assessment Authority (SEIAA), Paryavaran Bhavan, Sector 10-A, Gandhinagar-382 010, has accorded Environmental Clearance for Setting up of Synthetic Organic Chemicals Manufacturing Plant at Plot No. 6101/B, GIDC Ankleshwar, Dist: Bharuch. (Guj) of M/s. KAD PHARMACEUTICALS vide letter No. SEIAA/GUJ/EC/5(f)/942/2020 Dated 19/08/2020, under the provision of EIA Notification dated 14 September 2006. Copies of Clearance letter are available with website of SEIAA/SEAC
AUTHORIZED SIGNATORY
M/s. KAD PHARMACEUTICALS
Date : 19/08/2020

RAGHUVIR SYNTHETICS LIMITED
Regd Office : Rakhial Road, Rakhial, Ahmedabad-380023. CIN : L1719GJ1982PLC005424
NOTICE
Pursuant to regulation 29 read with regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations 2015, NOTICE is hereby given that a meeting of the Board of Directors of the company is scheduled to be held on 7th September, 2020 at registered office of the company situated at M/s. Raghuvir Synthetics Limited, Rakhial Road, Rakhial, Ahmedabad-380023. Inter alia, to consider, approve and take on record the un-audited financial results of the company for the quarter ended on 30th June, 2020. Further, details are also available on stock exchange's website i.e. www.bseindia.com and on company's website i.e www.raghuvir.com
BY ORDER OF THE BOARD
RAGHUVIR SYNTHETICS LIMITED
SUNIL R. AGARWAL
CHAIRMAN & MANAGING DIRECTOR
DIN NO. : 00265303
PLACE : AHMEDABAD
DATE : 21-08-2020

The Surat People's Co-op. Bank Ltd.
Esttd.: 1922 Multi State Scheduled Bank
Regd./Central Office: "Vasudhara Bhavan", Timliyavang, Nandura, Surat-395001.
Tel.: (+91-0261)246 4621 to 4624 Fax: (+91-0261) 246 4577 & 4592
email: info@spcbil.in | Toll Free: 18002337722 | Website: www.spcbil.in

APPENDIX-IV (Rule-8(1)) POSSESSION NOTICE (For Immovable Property)
WHEREAS The undersigned being the Authorized Officer of The Surat People's Co-Op Bank Ltd. under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 had issued demand notice under section 13(2) dated 07/01/2020 Calling Upon the
Borrower : (1) M/s. Shree Bhairav Designer A/c No. 304006604310
Prop. Ashokkumar Mamal Mandot
Office / Shop : Shop No. A-908, 9th Floor, Aditya Awass, Old Bombay Market, Umarwada, Surat.
Res. 1 : 802, Arjun Complex, B.S. Uma Bhavan, Bhatar Road, Surat.
Res. 2 : Flat No.A/704, Maninadra Apartment, Opp. Suman Awass, Vesu-Vip Road, Surat.
Guarantors : (2) Aniladevi Rajendrakumar Mandot
(3) Rajendrakumar Mamal Mandot
(4) Santoshdevi Ashokkumar Mandot

To repay the total amount mentioned in the notice being pay Rs. 25,07,629/85 (Rupees Twenty five Lakh Seven Thousand Six Hundred Twenty Nine And Paise Eighty Five Only) as on 08/01/2020 together with further contractual interest thereon till the date of payment and incidental expenses, costs, charges, incurred / to be incurred, within sixty days from the date of receipt of the said notice.
The Borrower/Guarantors having failed to repay the amount, notice is hereby given to them and the public in general that the undersigned has taken **SYMBOLIC Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 20th August, 2020.
The Borrower/Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of The Surat People's Co-Op. Bank Ltd. For an amount of Rs. 25,07,629/85 (Rupees Twenty five Lakh Seven Thousand Six Hundred Twenty Nine And Paise Eighty Five Only) as on 08/01/2020 together with further contractual interest thereon till the date of payment and incidental expenses, costs, charges, etc. due from the borrower(s) and interest thereon.
The Borrower's attention is invited to the provisions of Sub-Section (8) of Section 13 of the SARFAESI ACT, in respect of time available, to redeem the secured asset.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES
Name of the owner: Ashok Mamal Mandot (HUF)
Shop No. 908/A Type, 9th Floor, ADATYA AWASS, Bombay Market Art Silk Co-op. (Shops &Warehouses) Society Ltd. Near Sahara Darwaja, Umarwada, Surat. R.S.No. 67 to 74 & 76-77, T.P.S. No.8, Umarwada, F.P.No.42 Area of Shop : 85.003 Sq.mtr. Built up Area : 915 sq.ft. Carpet Area : 815 sq.ft.
Sd/- Ashutosh J. Kapadia
Asst. General Manager & Authorized Officer
The Surat People's Co-Op. Bank Ltd.
Date : 20/08/2020
Place : Surat

SAANVI ADVISORS LIMITED
Regd. Office : 304, Shopper's Plaza - V, Government Servants Co-op. Housing Society Limited, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad - 380 000. Phone No. : 079-48904153 CIN : L74140GJ1981PLC084205
Email : sapharishini@gmail.com Website : www.sapharishini.in
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER AND THREE MONTHS ENDED ON 30th JUNE, 2020 (In Rupees)

Particulars	Quarter ended on 30-06-2020 (Unaudited)	Quarter ended on 31-03-2020 (Audited)	Quarter ended on 30-06-2019 (Unaudited)	Year ended on 31-03-2020 (Audited)
- Total Income from Operations	1,786,121	667,465	587,193	2,437,490
- Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	1,154,175	(2,193,559)	(201,663)	(2,279,980)
- Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	1,154,175	(2,193,559)	(201,663)	(2,279,980)
- Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary Items)	803,576	(1,897,893)	(201,663)	(1,784,114)
- Total Comprehensive Income for the period (Comprising Profit / or loss for the period (after tax) and other comprehensive income (after tax))	803,576	(1,897,893)	(201,663)	(1,784,114)
- Paid-up equity Share Capital	20,105,000	20,105,000	20,105,000	20,105,000
- Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	2,804,261
- Earnings per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	-	-	-	-
- Basic	0.40	(0.84)	(0.10)	(0.89)
- Diluted	0.40	(0.84)	(0.10)	(0.89)

Notes :
1) The above is an extract of the detailed format of First quarter and Three months ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The Full format of the unaudited Financial Results is available on the stock exchange website - www.mseil.in & on company's website - www.sapharishini.in
2) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 20/08/2020.
3) The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter ended on 30th June, 2020 are in accordance with IND-AS and other accounting principles generally accepted in India.
4) Exceptional and / or Extraordinary Items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.
Date : 20/08/2020 For, Saanvi Advisors Limited
Place : Ahmedabad Roopesh Ved, Director - DIN: 01504998

OLYMPIC CARDS LTD
Regd. Off. : No.186, N.S.C. Bose Road Chennai - 600 001.
INCORPORATED IN INDIA. CIN: L65985TN1929PLC225291
E-Mail: info@olympiccards.com Website: www.olympiccards.com
Telephone No. 044 42921001/1017; FAX No. 044 25393300
NOTICE
Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015.
NOTICE is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Saturday, 29th August, 2020 at the Registered Office of the Company at No.186, N.S.C. Bose Road, Chennai-600 001, inter alia, to consider, approve Unaudited Financial Results for the Quarter Ended 30th June, 2020 among other subjects.
This information is also available on the website of the company at www.olympiccards.com and on the website of the Bombay Stock Exchange Ltd.(BSE Ltd.) where the shares of the Company are listed at www.bseindia.com.
For **OLYMPIC CARDS LTD.**
Sd/- K. RAJESH ANANDMCC,
COMPANY SECRETARY
Place: Chennai Membership No. F3837
Date: 20.08.2020 Mob : 9840174388

SALASAR TECHNO ENGINEERING LIMITED
CIN: L23201DL2001PLC174076
Regd. Off: E-20, South Extension-I, New Delhi- 110049
Tel: +91-11-41648566/8577; Website: www.salasartechno.com
NOTICE
Notice is hereby given that, pursuant to Regulation 47(1) of the SEBI (Listing Obligations and Disclosures Requirements), 2015 (LODR), a meeting of the Board of Directors of the Company will be held on Thursday, 27th August 2020 at 4:00 P.M. at its Unit-3, Khasra No. 686/6, Khara Palkhwa, Tehsil Dhaulana, Distt.-Hapur- 245304. Inter-alia, to consider and approve the Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the Quarter ended 30th June, 2020. In accordance with Regulation 46(2) and 47(2) of LODR, the details of the said meeting are also available on website of the Company viz. <http://www.salasartechno.com> as well as on the website of Stock Exchanges at <http://www.bseindia.com> and at <http://www.nseindia.com>
By order of the Board of Directors
For Salasar Techno Engineering Limited
Sd/- (Rahul Rastogi),
Company Secretary
Date: 21st August, 2020
Place: New Delhi

SAGARDEEP ALLOYS LIMITED
CIN: L29253GJ2007PLC050007
Regd. Off. - Plot No. 2070, Rajnagar Pathya, Santej Khatraj Road, Santej, Kalol, Gandhinagar 382721 Phone No: +91 93270 36304
Email: secretary@sdealloys.com Website: www.sdealloys.com
NOTICE TO THE SHAREHOLDERS OF POSTAL BALLOT
NOTICE is hereby given that pursuant to Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (the "Act") read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, (the "Rules"), including any statutory modification(s), amendment(s) or re-enactment(s) thereof, for the time being in force and read with General Circular No. 14/2020 dated 6th April, 2020 and General Circular No. 17/2020 dated 13th April, 2020 issued by the Ministry of Corporate Affairs and Circular No. 20/2020 dated May 5, 2020 and also Securities Exchange Board of India, vide its circular No. SEBI/HO/JCFD/JCMI/D1/CIR/P/2020/9 dated May 12, 2020 ("Circular"), the Company will conduct Postal Ballot for seeking the approval of the Members of the Company for the businesses set in the Postal Ballot notice only through remote e-voting ("Postal Ballot/E-Voting").
In accordance with the aforesaid Circulars, Notice of the Postal Ballots being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may note that the said Notice and Postal Ballot Form will also be available on the Company's Website www.sdealloys.com and on website of the Stock Exchanges i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com respectively and the Postal Ballot Notice is also available on the website of CDSL (agency for providing the Remote e-Voting facility) i.e. www.evotingindia.com.
The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of Postal Ballot. In case of Member(s) who have not registered their e-mail addresses with the Company/Depository, are requested to please follow the below instructions to register their e-mail address for obtaining Postal Ballot Notice and login details for voting.
a. For members holding shares in Physical mode please provide necessary details like Folio No., Name of shareholder by email to secretary@sdealloys.com
b. Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by email to secretary@sdealloys.com
The Postal Ballot Notice will be sent to the shareholders holding shares as on cut-off date i.e. August 21, 2020 in accordance with the applicable laws on their registered e-mail addresses in due course i.e. on the E-mail ID registered and who had applied for registration on or before last date of sending postal ballot notice to the members.
In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058542/43.
For all grievance connected with the facility for voting by electronic means send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058542/43.
For, SAGARDEEP ALLOYS LIMITED
SATISHKUMAR ASAMAL MEHTA
Managing Director
(DIN:01958984)
Place: Santej
Date: August 21, 2020

State Bank of India
Stressed Assets Recovery Branch, Mumbai
6th Floor, The International Building, M.K Road, Churughate, Mumbai 400 020
Phone: 022 - 22053163 / 64 / 65 ; Email - sbi.05168@sbi.co.in

Notice is hereby given that the following Borrowers, M/s. Jayesh Lifescience India Pvt Limited (Borrower), and Mr. Dinesh Khushalbhaj Prajapati, Mr. Singheswar Jibachh Thakur, Mr. Nitinkumar Narayanbhai Prajapati, M/s. Dhruv Wellness Limited (Director/Guarantor) have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but they have been returned unreturned and as such they are hereby informed by way of this public notice.

Name of the Borrower	Details of Properties/ Address of Secured Assets to be Enforced	Date of Notice	Date of NPA	Amount Outstanding as on date of notice
M/s. Jayesh Lifescience India Pvt Limited Shop No.5, Bhavani Jyot Tower C.H.S. Ltd., Chandan park, Near Jesal Park, Bhayander (East), Dist. Thane 401105.	1. Hypothecation of Stocks, Book Debts, Receivables and entire current assets of the company on first Pari Passu basis with Axis Bank.	24.07.2020	28.10.2019	Rs. 4,04,40,508.00 (Rupees Four Crores Four Lacs Forty Thousand Five Hundred Eighty Only) as on 20.07.2020 future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges, etc.
Mr. Dinesh Khushalbhaj Prajapati C/o. Babulal A. Prajapati, Flat No.505, Mira Bhawan Building No. A/5, Dhanjivadi, Malad (East), Mumbai - 400097, and at Room No.404, Khot Kuas Road, Malakani Estate, Malad (East), Mumbai 400097	2. All that Flat Premises bearing No.507, on the Fifth Floor, having 41.07 sq.mtrs., Built up area thereabouts in the building known as BHAVANI JYOT TOWER Co-Op. Hsg. Soc. Ltd situated at Chandan Park, Bhayander (East), Dist. Thane Pin-401 105 situated on the piece of land bearing Old Survey No.152/P. 153/4, New Survey no. 27/P. 28/4, 5, situated lying and being in the Revenue Village "KHARI" of Bhayadar (E), Tal. & Dist. Thane and within the Jurisdiction of Mira-Bhayander Municipal Corporation, Bhayander owned by Shri. Nitinkumar Narayanbhai Prajapati.			
Mr. Singheswar Jibachh Thakur Al. Vill. Mahatwar, Tehsil Ghanshyampur, District Darbhanga, State Bihar, 847427.	3. Tenement No.C/9, "Sanskriti My Home" on Land bearing S. No. 1843/1, C.S. No.4356/37 of Village Dahegam, Sub-Dist. Dahegam, District Gandhinagar, Gujarat State, PIN - 382305 admeasuring 87.00 Sq.Mtrs on Land adm.71.55 sq.mtrs. owned by M/s. Dhruv Wellness Pvt. Limited.			

The steps are being taken for substituted service of notice. The above Borrower(s) and /or their Guarantor(s) (whenever applicable) are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.
First Notice under Section 13(2) of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 issued on 29.10.2019 by Authorised Officer of State Bank of India, (Chief Manager, Diamond Garden Chembur Branch) stands withdrawn and is deemed ineffective.
Also, Notice under Section 13(4) of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 issued on 24.02.2020 (For Bhayander property) and dated 27.02.2020 (for Dahegam, Gujarat property) by Authorised Officer of State Bank of India, (Chief Manager, Diamond Garden Chembur Branch) stands withdrawn and is deemed ineffective.
The Borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act. In respect of time available to redeem the secured assets.
Sd/-
Date: 20.08.2020
Place : Mumbai Authorized Officer
State Bank of India

Indian Overseas Bank Regional Office: 3rd floor, Aries Complex, B.P.C. Road, Alkapuri, Vadodra, Gujarat-390005
Ph: 0265-2960012, 2960015.

E AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES (under Provision to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules)

E-Auction Sale notice for sale of immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest, 2002 read with provision to Rule 8(6) of the Security (Enforcement) Rules 2002. Notice is hereby given to the public in general and in particular to the borrowers and guarantors that the below described immovable property mortgaged to the secured creditor, the physical possession of SI No. 1 and constructive possession of all other properties has been taken by the Authorised Officer of Indian Overseas Bank, Secured creditor will be sold on "As is where is" "as is what is" and "Whatever there is" on 10.09.2020 for recovery of amount as under, with further interest at contractual rates and rests, charges etc, due to Indian Overseas Bank, secured creditors. The sale will be done by undersigned through e-auction platform provided at the web portal <https://www.mstcecommerce.com/auuctionhome/lbapl>

Mega E-Auction Date & Time: 10.09.2020 between 11.30 am to 03.30 pm with auto extension till sale is completed

RESIDENTIAL PROPERTIES					
Sr. No.	Branch	Name of the Borrower	Description of Property	Reserve Price	Due Amount Plus uncharged Interest
				EMD Amount	
01	Katargam	Shri Arvindbhai Laljibhai Bhogani (Borrower/Mortgagor), Smt. Harshaben Arvind Bhogani (Borrower/Mortgagor) Shri Dilip Shivabhai Patel (Guarantor)	All that Piece and Parcel of Equitable Mortgage followed by registered memorandum of property situated at Flat No 302 on Third Floor of "Maa Bhavani Complex" Unit of "Suvridha (Simada) Co-op Housing Society Ltd" Constructed on Sub Plot No. F/1 of Revenue Survey No. 70/1, Its Block No.103,Revenue Survey No. 70/2 its Block No. 104 Situated at Moje Village Simada (Present Puna) Sub District City Surat District Surat admeasuring 120.50 sqmt, owned by Mr. Arvindbhai Laljibhai Bhogani, Mrs. Harshaben Arvindbhai Bhogani as per sale deed no. 6064 dated 02.06.2016 with all rights therein. Boundaries: East: Main Entrance/Passage, West: Open Margin/Road, North: Open Margin/Adjoining Survey No., South: Adjoining Flat Unit No. 301.	Rs. 21,00,000/- Rs. 2,10,000/-	As on 20.08.2020, Rs. 22,47,359.72 payable together with further interest at contractual rates and rests along with costs, charges etc.
02	Adajan	Shree Yamunaji Art Prop: Mr. Girish Vrajlal Dohariya Mr. Dharmendra Vrajlal Dohariya (Guarantor & Mortgagor) Mr. Jaydeep Barvaliya (Guarantor)	1. EM followed by a registered memorandum of property bearing Block Number 314, 316, 317, 319, 327, 328, 329, 330 and 334, Plot No. 190-J (F Type) "Joy N JOY" Moje -Navi Pardi, Kamrej, Surat 394155 Owned by Girish V Dohariya. Bounded: North: Plot no 190-K, South: Plot No 190-I, East: Road, West: Plot no. 23.	Rs. 46,50,000/- Rs. 4,65,000/-	As on 20.08.2020, Rs. 1,14,96,700.95 payable together with further interest at contractual rates and rests along with costs, charges etc.
			2. EM followed by a registered memorandum of Property Bearing at Row House/Plot No. 191, (Old Plot No. 180), "Ashirwad Society" Revenue Survey No 181 & 158, Block No. 152, T.P. Scheme No. 22, F.P. No 9 admeasuring 78.04 S.M. situated at Moje Sarthana, Sub District Kamrej, District Surat 395006, owned by Dharmendra Vrajlal Dohariya. Bounded: North: Society Road, South: Old Plot No. 172, East: Old Plot No. 179, West: Old Plot No. 181.	Rs. 68,18,200/- Rs. 6,81,820/-	

Property Inspection Timing : 24.08.2020 10.00 am to 07.09.2020, 3.00 pm For further details, terms and conditions, interested bidders can visit our Bank's website at <https://www.ioab.in/Auctions.aspx> and submit bid for participation in this E-Auction through website at <https://www.mstcecommerce.com/auuctionhome/lbapl/> or Contact: Mr. Sunil Gupta Mob: 90825 80028, Mr Aadiya Mohan Mob: 90994 68003 & Mr. Gaurav Singh Mob.: 72278 82345

This may be treated as a Notice under Rule 8(6) of the Security (Enforcement) Rules 2002 to the borrower/s and guarantors of the said loan about holding of a auction on the above mentioned date.
Place: Vadodara - Date: 22/08/2020
Authorised Officer - Indian Overseas Bank

COSMOS BANK
THE COSMOS CO-OP BANK LTD. (Multistate Scheduled Bank)
Office of the Authorised Officer and Chief Manager
Kothipole Branch
7 Kothipole, Raopura, Vadodara-390001 Contact Nos : 0265 2422440 - 2422442
APPENDIX IV - SYMBOLIC POSSESSION NOTICE

(Under rule- 8(1)) FOR Immovable Property
The account of the below mentioned borrower of Alkapuri branch has become NPA on 31.12.2008 and Demand Notice dated 18.02.2009 has been issued by the Authorised Officer of the Bank, u/s 13(2) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (hereinafter called "the Act") through Registered Post, to the Borrower/Guarantors/Mortgagor.
This Demand Notice is hereby given U/s 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) read with Rule of the Security Interest (Enforcement) Rules, 2002 hereinafter calling upon the under mentioned Borrower/ Guarantors / Mortgagor; 1). **M/s. Baroda Auto Center (Partnership Firm)**, Partners 1. **Mr. Devang Harshadhbhai Patel 2. Mr. Gaurang Harshadhbhai Patel 3. Mr. Girishbha Madhubhai Patel (HUF)**, to repay the amount mentioned in the notice being Rs. 5,29,91,370.19 (Rs. Five Crores Twenty nine Laks Ninty One thousand Three hundred seventy and Nineteen paise) as on 31.01.2009 + interest within 60 days from the date of receipt of the said notice. In terms of this Notice U/s 13(2) of the Act, the Bank will exercise all or any of the rights under Sub-section (4) of Section 13 and under other applicable provision of the said Act.
The Borrowers, Guarantors & Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers, Guarantors & Mortgagors and the public in general, that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with rule 8 of Security Interest (Enforcement) Rules, 2002, on 21.08.2020
The Borrowers, Guarantors & Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of The Cosmos Co Op. Bank Ltd., Alkapuri Branch, Vadodara for an amount of Rs. 9,94,94,023.66 (Rs. Nine Crores Ninety Four Lakhs Ninety Four thousand Twenty Three and sixty six paise) as on 31.07.2020 + further interest & charges thereon.
The Borrower attention is invited to provisions of Sub-Section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

Name of the Borrowers Guarantors / Mortgagors	Description of the Mortgaged / Charged Property	Amount Outstanding
Cash Credit A/c.No: 06460010204 Branch : Alkapuri Borrower: M/s. Baroda Auto Center (A partnership Firm) 1. Mr. Devang Harshadhbhai Patel 2. Mr. Gaurang Harshadhbhai Patel 3. Mr. Girishbhai Madhubhai Patel (HUF)	1. Immovable Property belonging to M/s. Baroda Auto Center-A Partnership Firm All that piece and parcel of the premises Reg. Dist. Sub Dist. Vadodara, Vibhag Vadi, R.S. No. 204/2, 206/2/P. C.S. No 3003/3, Paiki, 665 Sq. Mt. and 3003/2, Paiki, 101.12 Sq. Mt. Near BOB Pratapnagar, Vadodara 2. Property belonging to Mr. Devang Harshadhbhai Patel & Mr Gaurang Harshadhbhai Patel legal heirs of Late Mr. Harshadhbhai Kantilal Patel. All that piece and parcel of the premises Reg. Dist. Sub. Dist. Vadodara, Moje Kasba, (Sayajigunj) R.S.No.451, Tikka No 19/74/2, C.S. No. 147 & 148 D-1, D-2, Shreeji Co-Op Housing Society, Sayajigunj, Vadodara admeasuring 194.51 Sq.Mt	As on 31.07.2020 Rs. 9,94,94,023.66 + Interest, Cost and Other charges

Date: 21.08.2020
Place : Vadodara
Authorised Officer and Chief Manager
The Cosmos Co-Op Bank Ltd

Business at your finger tips



Exclusive content, hand-picked by our editors

Stay on top of your investments. Track your portfolio in real-time.

Watch the industry and companies of your choice

Curated newsletters - Market View, Personal Finance, Today's Special, BS Views

21 years of archival data

Unlimited content access from all devices

BS premium digital at ₹1499/year

For details, SMS reaches to 57575 or email order@bsmail.in

Business Standard
Insight Out